

# શ્રી લેવા પાટીદાર બોર્ડિંગ, ભચાઉ – ૫૨૭

:- નિયમાવલી (વર્ષ : ૨૦૧૮ – ૨૦૧૯) :-

પિતા/વાતીએ આ નિયમો બરાબર વાંચવા અને પછી જ પ્રવેશફોર્મની વિગતો ભરવી.

## ૧. પ્રવેશ અંગે:-

- સંસ્થામાં ધો-૬ થી ૧૨ માં દાખલ થવા છચ્છતા વિદ્યાર્થીના વાતીએ પ્રવેશફોર્મ સંસ્થાની ઓફિસેથી મેળવી લેવાનું રહેશે.
- પ્રવેશફોર્મ વાતીએ જાતે જ ભરી પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોટાડી મોડામાં મોઝું ૩૧ મી મે સુધી સંસ્થાની ઓફિસે મોકલી આપવાનું રહેશે. સમયમર્યાદા બહાર આવેલ ફોર્મ અંગે કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં આવશે નહીં. ઇતાં પણ યોગ્ય કારણ જણાય તો કુલ લવાજમ દરે પ્રવેશ આપવામાં આવશે.
- શાળા છોડવાનું પ્રમાણપત્ર તેમજ છેલ્લી વાર્ષિક પરીક્ષાનું પરિણામપત્રક શાળા ખુલવાના પ્રથમ અગાર બીજા દિવસે ૨૪ કરવાના રહેશે, યોગ્ય કારણો વગર તે ૨૪ ન કરનારનો પ્રવેશ રદ્દ કરવામાં આવશે.
- પ્રવેશફોર્મ મંજુર થવા અંગે આપશ્રીને જાણ કરવામાં આવશે. સાથોસાથ સંસ્થામાં વિદ્યાર્થીને દાખલ કરવા આપવાની તારીખ પણ આપવામાં આવશે. તો તે જ તારીખે જરૂરી ફી ની રકમ તેમજ વસ્તુઓ સાથે વિદ્યાર્થીના વાતીએ જાતેજ દાખલ કરવા આવવું પડશે. અનિવાર્ય કારણોસર પ્રથમ દિવસે વિદ્યાર્થીને દાખલ કરવા આવી શકાય તેમ ન હોય તો તે અંગેની લેખિતમાં જાણ સંસ્થાની ઓફિસમાં કરવાની રહેશે. કોઈ પણ કારણ જણાવ્યા વગર પ્રથમ દિવસે હાજર ન થનાર વિદ્યાર્થીનો પ્રવેશ રદ્દ કરવામાં આવશે.
- વિદ્યાર્થીના લગ્ન કરી દીઘેલ હોય તેવા વિદ્યાર્થીને સંસ્થામાં કોઈપણ ધોરણમાં કોઈપણ સંજોગોમાં પ્રવેશ આપવામાં આવશે નહીં અને સંસ્થામાં ચાલુ અભ્યાસે લગ્ન કરી શકશે નહીં અને સંસ્થાના ચાલુ અભ્યાસે લગ્ન કરનાર વિદ્યાર્થી સંસ્થામાંથી આપોઆપ છૂટો થયેલ ગણવામાં આવશે.
- વિદ્યાર્થીને કોઈ પણ સામાન્ય બિમારી હોય તો તેની જાણ કરવી ફરજીયાત છે, અસાધ્ય રોગથી પીડાતા વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવશે નહીં. મંજુર કરેલ પ્રવેશફોર્મ પાછળથી રદ્દ પણ કરી શકશે.
- તેમજ રજાઓમાં વિદ્યાર્થી ધરે આવે ત્યારે બિમાર થાય અને તેની દવા કરો તો તેની પણ જાણ કરવી ફરજીયાત છે.
- સંસ્થાનું પ્રવેશફોર્મ સંસ્થાની ઓફિશીયલ વેબસાઇટ [www.slpb.org](http://www.slpb.org)પરથી ડાઉનલોડ કરી ફોર્મની વિગતો ભરી સંસ્થાની ઓફિસે પહોંચાડી શકશે. આ સિવાય રાપર કન્યા ધાત્રાલય ખાતેથી પણ ફોર્મ મળી શકશે.

## ૨. લવાજમના દરો અને ફીની રકમ ભરવા અંગે:-

- લવાજમના માસિક દર આ મુજબના છે : - 750 અને 1000. ધોરણ-૧૦ બાદ અભ્યાસ કરવા છચ્છતા વિદ્યાર્થીએ 1000 રૂ. નો લવાજમ દર ભરવાનો રહેશે.
- લવાજમના દર સામાન્ય સભામાં નક્કી થઈ ગયા બાદ અધિકારીઓને જો પરિસ્થિતિ મુજબ લવાજમમાં સુધારો કરવાની જરૂર જણાશે તો તે મુજબ સુધારો કરી શકશે, જે વિદ્યાર્થીના વાતીને બંધનકર્તા રહેશે.
- જ વિદ્યાર્થીનું ફોર્મ મંજુર થાય તેવા વિદ્યાર્થીના વાતીએ રૂ. 100 પ્રવેશ ફી ભરવાની રહેશે. જે કોઈ પણ સંજોગોમાં પરત મળી શકશે નહીં.
- મંજુર થયેલ લવાજમની રકમ દર ૬ (૬) માસની એડવાન્સમાં ભરવાની રહેશે. અધવચ્ચે સંસ્થા છોડી જનાર વિદ્યાર્થીને કોઈ પણ સંજોગોમાં લવાજમ પરત મળી શકશે નહીં, સમયસર લવાજમ ન ભરનાર વિદ્યાર્થીને સંસ્થામાંથી છૂટો કરવામાં આવશે.
- સંસ્થામાં આવતી રજાઓ અથવા પડતા વેકેશનો તેમજ કોઈ કારણોસર વિદ્યાર્થી રજા પર જાય તેવા દિવસોનું પણ લવાજમ વસૂલ કરવામાં આવશે. એટલે કે બાર માસનું પુરું લવાજમ વસૂલ કરવામાં આવશે.
- આક્સિક સંજોગોમાં અધવચ્ચે સંસ્થામાં જે વિદ્યાર્થીને પ્રવેશ મંજુર આપવામાં આવશે તે વિદ્યાર્થીને 12 (બાર) માસનું લવાજમ ભરવાનું રહેશે.

7. વિદ્યાર્થીના પર ચુરણ ખર્ચ માટે અંગત ખાતામાં ઓછામાં ઓછા રૂ. 1000/- શરૂઆતમાં જમા કરાવવાના રહેશે. જે વિદ્યાર્થીને જરૂરિયાત મુજબ આપવામાં આવશે. તેમજ પ્રાથમિક સારવાર બાદ કરતાં વધુ માંદગીનું ખર્ચ તેમાંથી લેવામાં આવશે.
  8. સરકારશ્રીના નિયમ મુજબ શાળામાં લેવાતી ફી વિદ્યાર્થીએ ભરવાની રહેશે.
  9. સંસ્થામાંથી છૂટા થનાર વિદ્યાર્થીનું કોઇ પણ જાતનું લેણું બાકી હશે તો તે ભર્યા સિવાય શાળા છોડ્યાનું પ્રમાણપત્ર શાળામાંથી કાઢી આપવામાં આવશે નહીં. અશિસ્ત આચરનાર વિદ્યાર્થીને સંસ્થા જો છૂટો કરશે તો તેવા વિદ્યાર્થીઓને લવાજમની રકમ પરત મળશે નહીં.
3. રજા અંગેના નિયમો:-
1. વિદ્યાર્થી નીચેના પ્રસંગોએ જ પોતાના ઘેર જઈ શકશે. તે પણ જવાબદાર વાલી લેવા આવે તો જ રજા આપવામાં આવશે. તે સિવાય રજા આપવામાં નહીં આવે.
    1. શાળા/સંસ્થામાં વેકેશનની રજાઓ.
    2. વિદ્યાર્થીને વિશેષ માંદગી થઈ હોય.
    3. નિકટના સંબંધી ભયંકર માંદગીમાં હોય.
    4. વાલી ભયંકર રોગથી પીડાતા હોય.
    5. વિદ્યાર્થી સાથે લોહીના સંબંધ ધરાવતી વ્યક્તિનાં લગ્ન હોય.
    6. વિદ્યાર્થી સાથે લોહીના સંબંધ ધરાવતી વ્યક્તિનું અવસાન થયેલ હોય.
 > તે સિવાય પ્રેત ભોજન, આણા પરિયાણા કે અન્ય પ્રસંગોમાં કોઇ પણ વિદ્યાર્થીને રજા આપવામાં આવશે નહીં.
  2. વિદ્યાર્થીના વાલીએ વિદ્યાર્થીને ઘેર આવવાની રજા લેવાની હોય તો વાલીએ રૂબરૂ આવી લેખિતમાં રજાચિહ્ન આપવાની રહેશે.
  3. ઉનાળુ/દિવાળી વેકેશન દરમાન કોઇ પણ વિદ્યાર્થી સંસ્થામાં રહી શકશે નહીં. સંસ્થા પોતાની જરૂરીયાત વાળા વિદ્યાર્થીઓને રોકી શકશે.
  4. રજા લઈને ગયેલ વિદ્યાર્થીને સમયસર હાજર થવાનું રહેશે. ચોગય કારણો વગર સમયસર હાજર ન થનારને શિક્ષા કરવામાં આવશે.
  5. સંસ્થાને જરૂર જણાય તો શાળામાં આવતી રજાઓને ધ્યાનમાં લઈ ઘેર જવાની સામૃહિક રજા આપવામાં આવશે, પરંતુ નિયત કરેલ ગૃહકાર્ય સાથે તેમજ નિયત કરેલ સમયે વિદ્યાર્થીને અવશ્ય હાજર થઈ જવાનું રહેશે.
4. વિદ્યાર્થીને સંસ્થામાં મળવા અંગેના નિયમો:-
1. બંને સત્રોની શરૂઆત થયા બાદ જે તે માસના છેલ્લા રવિવારે જ વાલી પોતાના બાળકને મળવા આવી શકશે.
  2. વિદ્યાર્થીના ભાઈ-બહેન માતા-પિતા હ્યાત ન હોય અગાર કચ્છ બહાર વસતા હોય તેવા વિદ્યાર્થીઓને તેના મુખ્ય જવાબદાર વાલી જ મળવા આવી શકશે. આવા જવાબદાર મળવા આવનાર વાલીનું નામ સત્રની શરૂઆતમાં આપવાનું રહેશે.
  3. કોઇ પણ સંજોગોમાં વાલી ગૃહપતિશ્રીની રજા વગર વિદ્યાર્થીને સંસ્થામાં મળી શકશે નહીં.
  4. સંસ્થાની ચાલુ નિત્યકમ કે અભ્યાસના સમયે વિદ્યાર્થીને મળી શકશે નહીં. ચાલુ શાળાએ વિદ્યાર્થીને કોઇ પણ સંજોગોમાં મળી શકશે નહીં. જરૂર કારણ જણાય તો ગૃહપતિશ્રી તે અંગે મંજરી આપી શકશે.
  5. વિદ્યાર્થીને મળવા આવનાર વાલીએ પોતાનું પુરનામ, સરનામું, સંસ્થામાં રાખવામાં આવેલ રજીસ્ટરમાં પ્રથમ નોંધવવાનું રહેશે. ત્યારબાદ ગૃહપતિશ્રીની રજા મજ્જેથી વિદ્યાર્થીને મળી શકશે.
  6. વાલીએ વિદ્યાર્થીને વાપરવાના પૈસા આપવા નહીં તથા વિદ્યાર્થીએ પણ પોતાની પાસે રાખવા નહીં. ફક્ત ગૃહપતિશ્રી પાસે જ તેના ખાતામાં જમા કરાવી દેવાના રહેશે.
  7. વિદ્યાર્થી સંસ્થામાં રોકડ રૂપિયા, કોઇ પણ કિંમતી ઘરેણાં, ઘડિયાળ વગેરે પહેરી શકશે નહીં. આ વસ્તુઓ કે રૂપિયા ગુમ થશે તો તેની જવાબદારી સંસ્થાની રહેશે નહીં. રેડિયો, મોબાઇલ, વોકમેન, ગેઇમ કે અન્ય ઇલેક્ટ્રોનિક સાધનો રાખી શકશે નહીં, આ વસ્તુઓ જપ્ત થયેથી પરત મળશે નહીં. તેમજ મોબાઇલ રાખનાર વિદ્યાર્થીને સંસ્થામાંથી બરતરક કરવામાં આવશે.

##### 5. અન્ય જરૂરી નિયમો:-

- સંસ્થામાંથી વિદ્યાર્થી રજા લીધા સિવાય ભાગી જશે તો તે અંગેની કોઈ પણ પ્રકારની જવાબદારી સંસ્થાની રહેશે નહીં. સંસ્થામાંથી ભાગી જનાર વિદ્યાર્થી ઘર પહોંચી આવે એટલે વાલીએ તાત્કાલીક તે જ દિવસે મુદામ માણસ મોકલી સંસ્થાને તેની લેખિત જાણ કરવાની રહેશે. ભાગી જનાર વિદ્યાર્થીને કોઈ પણ આકસ્મિક કે કુદરતી કે અન્ય પ્રકારે નુકસાન થશે તો તેની જવાબદારી સંસ્થાની રહેશે નહીં. સંસ્થામાં વિદ્યાર્થી દાખલ કર્યા બાદ કોઈ પણ બિમારી કે આકસ્મિક/કુદરતી અકસ્માતના કારણે મૃત્યુ થશે તો તેવા સમયે સંસ્થા કોઈ પણ પ્રકારે જવાબદાર રહેશે નહીં.
- રજા લીધા સિવાય ભાગી જનાર અનેઅભ્યાસ ન કરવા ઈચ્છતાવિદ્યાર્થીના વાલીએ સંસ્થાએ આપેલ વસ્તુઓ દિન-10 (દશ) માં જમા કરાવી જવાની રહેશે. અન્યથા તેની રકમ વસુલ કરવામાં આવશે અને જે વાલી આપવા માટે બંધનકર્તા રહેશે. વિદ્યાર્થીના ધરનો સામાન સંસ્થા દિન-7 (સાત) સુધી સાચવશે. ત્યાર બાદ તેનો નિકાલ કોઈ પણ પ્રકારની જાણ વગાર સંસ્થા પોતાની રીતે કરશે.
- સંસ્થામાં એક વખત પ્રવેશ લીધા બાદ સંસ્થા છોડી જનારને પુનઃપ્રવેશ કોઈ પણ સંજોગોમાં આપવામાં આવશે નહીં.
- વિદ્યાર્થીને સમયાનુસાર નોટબુક, બોજન માટેના વાસણો, ગાડલું, તકીયો, તેલ, સાબુ જેવી વસ્તુઓ સંસ્થા પુરી પાડશે. જેની વિદ્યાર્થીએ પુરી જાળવણી કરી પરત આપવાની રહેશે. અન્યથા ગુમ કરવામાં આવેલ વસ્તુઓની રકમ વસુલ કરવામાં આવશે. સંસ્થા ઉપરોક્ત વસ્તુઓ આપવાનું બંધ પણ કરી શકશે.
- વિદ્યાર્થીએ દાખલ થતી વખતે સ્વખર્યે નીચેની વસ્તુઓ સાથે લાવવાની રહેશે.
  - જે-તે ધોરણના પાઠ્યપુસ્તકો તથા જોઇતા અન્ય પુસ્તકો, કંપાસ, રેગપેટી અને તાણું - 1
  - પ્રાથમિક વિલાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ સ્વાધ્યાયપોથી સાથે લાવવી.
  - શાળા ગણવેશના કાળા બુટ (સ્કુલ બુટ) જોડી - 1, કાળા મોજા જોડી - 2
  - કબાટ માટે તાળુ - 1, ચિત્રકલા માટે કલર- ડીસ, - પીંછી - 1
  - ઓફવા માટે ઝતુ અનુસાર ચાદર / સાલ / ગોડડુ - 1
  - નહાવાનો ટુવાલ - 1, ચડી(જાંગીયા) નંગા - 2, ચંપલ જોડી - 1
  - ચાલુ પહેરવાના કપડાં જોડી-3, કરસત માટે નેવી બદ્લું કલરની ચડી-1 તથા સફેદ ગંજુ નંગા - 2

##### 6. વિદ્યાર્થીને બરતરફ કરવા અંગેના નિયમો:-

- દાખલ થયેલ વિદ્યાર્થી અથવા તેના વાલી નિયત કરેલ નિયમોને ઇરાદાપૂર્વક ભંગ કરશે તેવા વિદ્યાર્થીને કોઈ કારણ આપ્યા સિવાય સંસ્થામાંથી છૂટો કરવામાં આવશે.
- કોઈ વિદ્યાર્થીની વર્તણૂક સંસ્થાના હિતોને નુકસાન કરનાર લાગશે તો અગાર તો તેની બીજા વિદ્યાર્થીઓ ઉપર ખરાબ અસર પડતી જણાશે તો તેવા વિદ્યાર્થીને સંસ્થામાંથી છૂટો કરી શકાશે.
- જો કોઈ વિદ્યાર્થી સંસ્થાની કોઈ મિલકતને નુકસાન કરશે તો તે અંગેની સંપૂર્ણ જવાબદારી તે વિદ્યાર્થી તેમજ તેના વાલીની રહેશે અને સંસ્થાના અધિકારીશ્રીઓ જે નુકસાનીનું વળતર માંગશે તે આપવાનું રહેશે. તેવા વિદ્યાર્થીને સંસ્થામાંથી તે જ ક્ષણે છૂટો કરવામાં આવશે.
- વિદ્યાર્થી જો કોઈ પણ પ્રકારનું વ્યસન કરતો માલુમ પડશે તો તેને સુધરવાની તક આપવામાં આપશે છતાં પણ જો તે સુધરશે નહીં તો તેને સંસ્થામાંથી બરતરફ કરવામાં આવશે. બીજા વર્ષે સંસ્થામાં દાખલ કરવામાં આવશે નહીં.
- વિદ્યાર્થીએ ગૃહપતિની આજાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આંતરિક નિયમોનું પાલન કરવાનું રહેશે, નિયમોનો ભંગ કરનાર વિદ્યાર્થી ઉપર અધિકારીશ્રીઓ જે નિર્ણય લેશે તે વિદ્યાર્થી અને તેના વાલીને બંધનકર્તા રહેશે. જરૂર જણાય તેને સંસ્થામાંથી કોઈ પણ કારણો આપ્યા વિના છૂટો કરી શકાશે.

##### 7. સંસ્થામાં લાભ લેતા છાત્રોએ પાળવાના આંતરિક નિયમો:-

- સવારથી કરીને રાત્રે સુવાના સમય સુધી નિયત કરવામાં આવેલ દિનચર્યાનું છાત્રોએ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
- પ્રાતઃકાર્યો અને અન્ય વર્ગો કે પ્રવૃત્તિમાં હાજરી આપવાના સમય સિવાયના સર્વે સમયમાં છાત્રોએ સંસ્થાના કર્પાઉન્ડમાં રહેવું, બહાર જવું હોય તો મુખ્ય વિદ્યાર્થી અથવા ગૃહપતિશ્રીની રજા મેળવ્યા પછી બહાર જવું.
- છાત્રાલયનું વાતારણ શાંત, સ્વચ્છ રહે તેમ દરેક છાત્રોએ વર્તણું, મોટેથી વાંચીને કે બીજી રીતે અવાજ કરીને અન્ય છાત્રોને અડચણ કે હરકત ન થાય તેમ વર્તણાનું રહેશે.

4. રાત્રે 09:15 કલાકે દરેક રૂમની બત્તી બંધ કરવામાં આવશે. 09:15 વાગ્યા પછી અભ્યાસ કરનાર છાત્રોએ નિયત કરેલી જગ્યાએ વાંચન કરવું.
  5. દરેક રૂમ માટે મુખ્ય મદદનિશ વિદ્યાર્થીની નિમણૂંક કરવામાં આવશે. છાત્રોએ તેમની સૂચના અને આદેશ અનુસાર વર્તન કરવાનું રહેશે. દરેક છાત્રોએ પોતાની જગ્યા તેમજ પોતાને મળેલ કબ્બાટ સ્વચ્છ રાખવું પડશે, તેમજ દરરોજ એક વખત ફરજીયાત ન્હાવું પડશે અને કપડાં સ્વચ્છ રાખવા પડશે.
  6. વિદ્યાર્થીઓ સવાર-સાંજ નિયત સમયે બોજનાલયમાં બોજન લેશે. કોઈ કારણસર બોજન ન લેવું હોય તો અગાઉથી ગૃહપતિને જાણ કરવી પડશે. બોજન લેતી વખતે છાત્રો અંદરો-અંદર વાતો કરી શકશે નહીં.
  7. છાત્રો સ્વાશ્રયી બને તે હેતુને નજરમાં રાખી કેટલાંક સ્વકારો છાત્રોએ પોતાને કરવાનાં રહેશે. જેવા કે, કપડાં ધોવા, વાસણ સાફ કરવા, વૃક્ષોને પાણી પાવું, શ્રમકાર્ય, એતીને લગતું કામ, શાકભાજુ સુધારવા, સ્નાનઘાટની સફાઈ, પીરસવાનું વિગેરે કાર્યો છાત્રોએ વારા પ્રમાણે કરવાના રહેશે.
  8. સંસ્થાના ઉદેશો વિદ્યાર્થીઓ સ્વાશ્રયી, શક્તિશાળી અને સ્વાવલંબી બનાવવાના છે. તેથી વ્યાચામ, અંગ કસરત, સંગીત, મનોરંજન, સંસ્કાર કાર્ય તથા બીજુ પ્રવૃત્તિઓ નક્કી કરવામાં આવે તે પ્રમાણે છાત્રોએ ફરજીયાત કરવી પડશે.
  9. છાત્રાલયનું કામ કરવું તે દરેક છાત્રની ફરજ છે. તે પ્રમાણે ગૃહપતિ અગર મંત્રીશ્રીએ તેમજ વિભાગનાં વડાએ આપેલ સૂચનાઓ અને આદેશ મુજબનું કામ અવશ્ય કરવાનું રહેશે.
  10. કોઈ પણ છાત્ર તેની મુલાકાતે આવનાર વાલીએ મળવા માટે ગૃહપતિની રજા મેળવવી પડશે અને રજા મેળવ્યા પછી નિયત કરેલી જગ્યાએ મળી શકશે.
  11. સાંજે સાડા પાંચ વાગ્યા પહેલા છાત્રોએ પોતાના ધોયેલા કપડાં ઘડી કરીને પોતાનાં કબ્બાટમાં રાખવા. આ નિયમનો અનાદર કરનારનાં કપડાં જપ્ત કરવામાં આવશે.
  12. છાત્રાલયમાં વિવિધ વિભાગો કે ખાતાઓનું કાર્ય ગૃહપતિ તેમને યોગ્ય લાગે તેવા છાત્રને આદેશ આપશે અને જે છાત્રને જે ખાતા કે વિભાગનું કાર્ય કરવાનો આદેશ આપવામાં આવે તે ખાતા કે વિભાગનું કાર્ય કાળજીપૂર્વક કરવાનું રહેશે.
  13. જે છાત્ર સંસ્થાના નિયમો, સૂચનાઓ કે આદેશોનો ભંગ કરશે તેમજ નિયમો વિરુદ્ધ વર્તન કરશે તો તે ખાતાનાં કે વિભાગનાં વડા તેની જાણ ગૃહપતિશ્રીને કરશે ગૃહપતિશ્રી તેને યોગ્ય શિક્ષા કરી શકશે.
  14. કોઈ પણ છાત્ર તેને આપવામાં આવેલ આદેશ કે સૂચનાનું પાલન અને અમલ આદેશ કે સૂચનાઓ પડકાર કે પ્રતિકાર કર્યો વિના કરશે.
  15. છાત્રાલયમાં સ્ટાઇનાં કર્મચારીઓ સાથે કોઈ પણ બાબત સબંધી સીધેસીધા વાદ વિવાદ કે તકરાર કરી શકશે નહીં. છાત્રને કોઈ પણ બાબત વિષે ફરીયાદ કરવાની હોય તો તે ગૃહપતિશ્રીને કરી શકશે અથવા મંત્રીશ્રીને ફરીયાદ કરવી હશે તો તે ગૃહપતિશ્રી દ્વારા કરી શકશે.
  16. સંસ્થાના ચાલુ નિયમો તથા ભવિષ્યમાં જે નિયમો સંસ્થાના હિતમાં બનાવવામાં આવે, તે નિયમો દરેકને બંધનકર્તા રહેશે. હાઇસ્ક્વુલ અથવા સંસ્થાના મકાનમાં દરેક છાત્રએ શિસ્ત અને સંપત્તી રહેવું.
  17. કોઈ પણ છાત્રએ દાગીના કે રોકડ રકમ પોતાની પાસે રાખવી નહીં કે બજાર, બહારની કોઈ પણ વસ્તુ ખાવી નહીં. પોતાને જોઈતી વસ્તુઓ છાત્રને વસ્તુભંડારમાંથી લાવી આપવામાં આવશે.
  18. કોઈ પણ છાત્ર રજા વગર રસોડામાં જઈ શકશે નહીં. રસોડા સમિતિનાં સભ્યો તેના વડાની સૂચના મુજબ રસોડામાં જઈ શકશે. કોઈ પણ છાત્ર રજા વગર એતીવાડી વિભાગમાં જઈ શકશે નહીં.
- ઉપરોક્ત તમામ નિયમો 1 થી 7 (પેટા નિયમો સાથેના) તથા આંતરિક નિયમો મેં અને મારા પુત્ર/પાલ્યએ વાંચેલ છે અને તે તમામ નિયમોનું પાલન કરવા અમો આથી બાંહેધરી આપીએ છીએ અને મારા પુત્ર/પાલ્યને કોઈ પણ આકસ્મિક/કુદરતી કે અન્ય પ્રકારે કોઈ પણ તકલીફ સંસ્થામાં કે સંસ્થા બહાર થશે તો તેની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. સંસ્થા કે તેના અધિકારીશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓ કે કર્મચારી કોઈ પણ પ્રકારે બંધનકર્તા રહેશે નહીં.

વિદ્યાર્થીની સહી

વાલીની સહી



“શિક્ષણ એ મનુષ્ય જીવનનો આધારસ્થંભ છે.”

# શ્રી લેવા પાટીદાર બોર્ડિંગ, ભચાઉ - ૫૮૭



પો. બો. નં. - 10, પિન કોડ નં. 370140, ફોન નં. (02837) 291044

Website: [www.slpb.org](http://www.slpb.org), E-mail: [slpbhbhachau@gmail.com](mailto:slpbhbhachau@gmail.com)

**ખાસ નોંધ:-** 31 મે પછી આવેલ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.

પ્રવેશ મેળવતાં દરેક વિદ્યાર્થીના વાલીએ જનરલ મિટિંગમાં ફરજીયાત આવવાનું રહેશે.

## પ્રવેશપત્ર

(વર્ષ : ૨૦૧૮ - ૨૦૧૯)

### 1. વિદ્યાર્થીની સામાન્ય માહિતી:-

અટક	વિદ્યાર્થીનું નામ	પિતા/વાલીનું નામ	દાદાનું નામ	માતાનું નામ

જન્મ તારીખ:-

સરનામું:-

તારીખ	માસ	વર્ષ	ઠેકાણું	ગામ	તાલુકો	જીલ્લો	પિન નંબર
મોબાઇલ નંબર:-	1	2	3	4	5	6	7

કયા ધોરણની પરીક્ષા આપી?

કયા ધોરણમાં દાખલ થવાનું છે?

વિદ્યાર્થીને કાયમી બિમારી / ઝોડ-ખાંપણ હોય તો જણાવવી

2. **માસિક લવાજમનો દર:-** એ માંથી એક લવાજમ દર પર (✓) નિશાન કરવું.

750	1000
-----	------

➤ ખાસ કારણોસર લવાજમનો દર

--

### 3. ખાસ સૂચનો:-

- દરેક ધોરણના વિદ્યાર્થીઓએ પાઠ્યપુસ્તકો સ્વખર્યે લાવવાના રહેશે.
- ધોરણ - 10 બાદ અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીએ 1000/- રૂ.નો લવાજમ દર ભરવાનો રહેશે.
- શાળા ગણવેશ જોડી-2 તથા બુટ-મુજા જોડી-1 વિદ્યાર્થીના સ્વખર્યે સંસ્થામાંથી આપવામાં આવશે.

આ સાથે આપેલા નિયમાવલીના નિયમો 1 થી 7 (પેટા નિયમો સાથેના) તથા આંતરિક નિયમો મેં તથા મારા સુપુત્રે વાંચ્યા છે અને તે નિયમોનું પાલન કરવા અમો બંધાઇએ છીએ.

વાલીની સહી

વિદ્યાર્થીની સહી

ઉપરની વિગતો તથા લવાજમનો જે દર ભરેલ છે તે મારી જાણ મુજબ બરાબર છે, તેની હું વર્તમાન દ્રસ્તીક્રી/અધિકારીક્રી તરીકે ખાત્રી આપું છું.

ફોર્મ તપાસ કરનારની સહી

ક્રમ	વર્તમાન દ્રસ્તીક્રી/અધિકારીક્રીનું નામ	સહી	વર્તમાન દ્રસ્તીક્રી/અધિકારીક્રીના મોબાઇલ નંબર
1			
2			